

## MEHTA INTEGRATED FINANCE LTD.

CIN NO : L65910GJ1985PLC007692

Date: 13/02/2023

To,  
**BSE Limited**  
Corporate Relationship Department  
Phiroze Jeejeebhoy Towers  
Dalal Street, Fort,  
Mumbai- 400001

**SCRIP CODE: 511377**

**Sub : Submission of copies of newspaper clippings pursuant to Regulation 47(3) of the SEBI  
(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Dear Sirs,

We wish to inform you that the Company has published the extract of the unaudited financial results (standalone and consolidated) for the quarter ended 31st December, 2022 in the following newspapers on 11.02.2023 pursuant to the Regulation 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015:


1. Lok Mitra - Gujarati Edition
2. Free Press - English Edition

We request you to take the above information on record.

Thanking You,

Yours faithfully,  
**For, Mehta Integrated Finance Limited**

**Kamleshbhai P. Patel**  
Company Secretary & Compliance Officer



# Dingucha case: Bail denied to agents in Ahmedabad

AHMEDABAD: A city sessions court on Tuesday refused regular bail to three agents who have been arrested in connection with the deaths of four members of a family from Dingucha, who froze to death while illegally crossing the US-Canada border in January last year. Additional sessions judge Hemang Trivedi rejected all the contentions raised by the three agents - Yogesh Patel, Bhavesh Patel and Dinesh Chaudhary - and denied them bail saying that their involvement was seen, prima facie, in a serious offence and that the investigation is at a nascent stage. The three were arrested by the detection of crime branch (DCB) last month, and booked on charges of cheating, culpable homicide not amounting to murder,

slavery and criminal conspiracy for human smuggling. The trio claimed innocence saying the victims from Dingucha - Jagdish Patel (39) wife Vaishali (37), daughter Vihangi (11) and son Dharmik (3) - died on the US-Canada border because they did not have adequate warm clothes, and the accused had nothing to do with this. They stated they cannot be held responsible for an incident that took place on the US-Canada border. They also argued the victims had gone to Canada on valid visas, and the crime began from Canada when they were walking to the US illegally, and the applicants had no role to play in this development. Moreover, they contended that the incident took place on the US-Canada border and the Ahmedabad city sessions

# 7,848cr as 'expenditure' Gujarat in revised SMC budget

Surat: In the revised budget presented by the standing committee on Tuesday, the capital expenditure was increased by Rs 191 crore from the earlier budget proposed by the municipal commissioner. Earlier, Rs 3,519 was proposed as capital expenditure, which was higher than Ahmedabad Municipal Corporation. Adding Rs 191 crore the standing committee approved Rs 3,710 crore for capital expenditure in the next financial year. The total capital and revenue expenditure of Rs 7,707 that was proposed by city municipal commissioner Shalini Agarwal, was revised to Rs 7,848 by the standing committee with an increase of Rs 141 crore. Standing committee chairman Paresch Patel presented the budget and announced reducing total taxes and charges by Rs 6 crore. Earlier, the Surat Municipal Corporation (SMC) proposed a hike in taxes and charges by Rs 307 crore which has been



AHMEDABAD: Gujarat CM Bhupendra Patel Kutch started the first meeting of the Tourism Working Group of the G-20 Presidency, which is being hosted by India, from Khordo, Kutch. He said that collective workings of the TWG meeting will give new direction and energy to the tourism sector.

Reduced to Rs 301 crore now. Following the reduction in taxes and charges, the revenue income of Rs 4,540 crore was brought down to Rs 4,534 crore. Standing committee also increased capital income by Rs 138 crore from Rs 2,976 crore to Rs 3,114 crore. Revenue expenditure has also been reduced by Rs 50 crore. "Total 18 urban health centres will be included in the National Quality Assurance Standard for better service to citizens. SMC will start two vans for care of senior citizens at a cost of Rs 25 lakh and later, another similar van will be added to each of the nine city zones," said Patel. SMC will start a centralized education cell for integration of education services and better management. AI-based attendance and monitoring of students through mobile app will also be provided. SMC will also develop one school in each zone under Cycle to School project. "As part of project students will be given a cycle," Patel added.

and geographical diversity, world-class tourist attractions, eco-tourism, green tourism and agritourism provide a unique experience to tourists. Through the development of tourism, new jobs are created and the overall development of the area is done economically as well as socially. Union Tourism Minister G. Kishan Reddy said that tourism is an important part of the country's growth engine. 6.9 million tourists visited India in the year 2022. While there are many varieties of tourism in India, the country is developing in the right direction as a tourism hub. India is becoming a safe and secure tourist destination for foreign tourists. He mentioned that the National Tourism Mission has also been created along with the new tourism policy for the development of tourism. Referring to tourism in development, the chief minister said that tourism has an important contribution to the GDP of the country and the world. Referring to the steps being taken towards making Gujarat a prosperous economy CM said that, Under the new tourism policy, a unique vision of environmental prosperity has been adopted along with the development of tourism in the state. Cabinet Minister Parshotam Rupala said that, Kutch has a rich geographical diversity including desert, sea and mountains and it is a matter of pride and good fortune for us to host the G20 in Kutch which is a hub of tourism. The G-20 chairmanship will further accelerate the journey towards building a holistic, inclusive and prosperous India. Talking about tourism opportunities in India, he added that India's cultural

**ZODIAC ENERGY LIMITED**  
CIN: L51909G1399ZPLC017694  
Regd. Office: U.G.F-4,5,6, Milestone Building, Near Khodiyar Restaurant, Near Drive In Cinema, Thaltej, Ahmedabad - 380054  
Phone: +91 - 79 - 2747 1193 / 17; E-mail: [ce@zodiacenergy.com](mailto:ce@zodiacenergy.com); Website: [www.zodiacenergy.com](http://www.zodiacenergy.com)

**Extract of Unaudited Financial Results for the quarter and nine months ended on December 31, 2022 (Rs. in Lakhs except EPS)**

Particulars	Quarter ended on 31/12/2022	Quarter ended on 31/12/2021	Year ended on 31/03/2022
	Unaudited	Unaudited	Audited
Total Income From Operations	2502.09	2011.25	14394.63
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	137.61	129.30	763.69
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	137.61	129.30	763.69
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	114.30	111.55	546.02
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	114.30	111.55	550.66
Equity Share Capital	1463.34	1463.34	1463.34
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year)	-	-	1,827.89
Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations):			
Basic: (not annualized for the quarter ended)	0.78	0.76	3.73
Diluted: (not annualized for the quarter ended)	0.78	0.76	3.73

Note:- The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the National Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Website of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com), [www.nseindia.com](http://www.nseindia.com) and Company's website at [www.zodiacenergy.com](http://www.zodiacenergy.com)

# Fire breaks out at Nandesari chemical plant

Vadodra: Fire broke out in the chemical plant of Deepak Nitrite Ltd at Nandesari-GIDC on Monday night. Heavy smoke billowed from the flames that were spotted near the gate of the plant. However, no person was injured in the incident. This is the second instance in the last nine months that a fire has broken out in the company's plant at Nandesari. The fire makes organic, inorganic, fine and specialty chemicals. It has its manufacturing units in Vadodra and in Dahej in Gujarat. Deepak Nitrite in a statement said: "A minor fire occurred in the open space area of the Nandesari plant on the night of February 6. The fire was completely doused within 20 to 25 minutes of the incident. There has been no injury to any person and the plant operations continue to remain smooth".

Two decades ago, the earthquake in Kutch killed many people and destroyed thousands of houses. But the state turned the calamity into an opportunity. Kutch has now recovered and is marching on the path of development. Rann utsav, which was started by the then chief minister and now Prime Minister Narendra Modi after seeing the immense potential of tourism along with industrial development in Kutch, has today become a

center of attraction for tourists from all over the world. The Prime Minister has given the desert of Kutch an important place in the map of the world. Referring to the five important priorities of the Tourism Working Group, the chief minister said that one of the five priorities is green tourism. The Smtirvan memorial built to commemorate the devastating earthquake in Kutch is an example of green tourism. Fifty check dams and planting of more than three lakh plants in this memorial forest have given a new direction to green tourism. Referring to tourism in development, the chief minister said that tourism has an important contribution to the GDP of the country and the world. Referring to the steps being taken towards making Gujarat a prosperous economy CM said that, Under the new tourism policy, a unique vision of environmental prosperity has been adopted along with the development of tourism in the state. Chief Secretary of State Rajkumar, Secretary of Department of Tourism, Government of India Arvind Singh, Principal Secretary of Finance Department Mona Khandhar, Senior Officials of Tourism and other Departments, various representatives of G-20 countries were present.

For, Zodiac Energy Limited -sd-  
Date: February 10, 2023  
Place: Ahmedabad  
Managing Director (DIN: 0622460)  
Kunjabihari Shah

**SYMBOLIC POSSESSION NOTICE**

**ICI Home Finance** (Registered Office: IICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai-400059)  
Corporate Office: IICI HFC Tower, JB Nagar, Andheri Kuria Road, Andheri East, Mumbai-400059  
Branch Office: 3rd floor, 301, Nakshatra-3, 150 Ft Ring Road, Near Raoya Telephone Exchange, Rajkot - 380007

Whereas  
The undersigned being the Authorized Officer of IICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.  
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(12) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IICI Home Finance Company Limited.

Sr. No.	Name of the Borrower/Co-borrower/ Loan Account Number	Description of Property/ Date of Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs.)	Name of Branch
1	Dhaval P Joshi (Borrower), Nayanaben Pratulbhai H Joshi (Co-Borrower), Pratulbhai H Joshi (Co-Borrower), LHRAJ0001322776	Plot No.22 P West Side Vadva Vadi Rajkot-380026, Bounded By- North: Plot No.21, South: Plot No.23, East: Plot No.47 Paiki, West: 750 Mtr Wide Road. Date of Possession-07-Feb-23	10-11-2022 Rs. 7,33,550/-	Rajkot-B
2	Dhaval P Joshi (Borrower), Nayanaben Pratulbhai H Joshi (Co-Borrower), Pratulbhai H Joshi (Co-Borrower), LHRAJ0001322777	Plot No.22 P West Side Vadva Vadi Rajkot-380050, Bounded By- North: Plot No.21, South: Plot No.23, East: Plot No.47 Paiki, West: 750 Mtr Wide Road. Date of Possession-07-Feb-23	10-11-2022 Rs. 5,11,740/-	Rajkot-B

The above-mentioned borrowers(s)/ guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: February 11, 2023  
Place: Rajkot  
Authorized Officer  
ICI Home Finance Company Limited

# Suraj Kaliya gang members booked under Gujarat Control of Terrorism and Organised Crime



SURAT: Police have booked members of Suraj Kaliya gang under the Gujarat Control of Terrorism and Organised Crime (GUJCTOC) Act for their alleged involvement in a series of crimes. Their involvement was found in 44 criminal cases over the past eight years. Police arrested Kuldip Thakur, Satish Yadav and Aniket alias Ankit alias Baua Rajput on Sunday. Gang leader Suraj Kaliya alias Suraj Saroj and his close aide Raj Malviya alias Raj Panda are already in jail.

**GOKUL AGRO RESOURCES LIMITED**  
CIN: L15142G1014PLC080010  
Registered Office: Crown-3, Inspire Business Park, Shantigram, Nr Vaishnoveji Circle, S.G. Highway, Ahmedabad, Gujarat, India  
E-Mail ID: [gari@gokulagro.com](mailto:gari@gokulagro.com); Tel No: +91 79 67123500; Website: [www.gokulagro.com](http://www.gokulagro.com)

**EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2022 (Rs. in Lakhs except EPS)**

SN	Particulars	Quarter Ended		Nine Months ended		Year ended
		31-Dec-22	30-Sep-22	31-Dec-22	31-Mar-22	
1	Total Income from Operations	2,74,786.78	2,77,965.98	8,39,436.59	10,40,734.71	
	Net Profit for the period					
2	(Before Tax After, Exceptional and/or Extraordinary Items)	4,827.73	3,900.69	12,450.57	15,598.20	
3	Net Profit for the period Before Tax (After Exceptional and/or Extraordinary Items)	4,827.73	3,900.69	12,450.57	15,598.20	
4	Net Profit for the period After Tax (After Exceptional and/or Extraordinary Items)	3,683.06	2,948.08	9,457.98	12,290.63	
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,828.89	3,278.29	10,208.48	12,491.11	
6	Equity Share Capital (Face value of Rs.2/- each)	2,861.45	2,861.45	2,861.45	2,861.45	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	44,166.59	
8	Earnings Per Share (of Rs.2/each) (for continuing and discontinued operations)					
1.	Basic:	2.57	2.06	6.61	9.02	
2.	Diluted:	2.57	2.06	6.61	9.02	

**MEHTA INTEGRATED FINANCE LIMITED**  
CIN: L65910G1985PLC007692  
Reg. Off: 003, Law Garden Apartment, Scheme-1, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006  
E-mail: [mifn@yaho.com](mailto:mifn@yaho.com); Website: [www.mehtaintegratedfinance.com](http://www.mehtaintegratedfinance.com); Ph: 079- 26561000

**Extract of the Standalone Un-audited Financial Results for the quarter and Nine Months ended 31st December, 2022 (Rs. in Lakhs except EPS)**

Sr. No.	Particulars	Quarter ended 31/12/2022	Quarter ended 30/09/2022	Quarter ended 31/12/2021	Nine Months ended 31/12/2022	Nine Months ended 31/12/2021	Year ended 31 March 2022
		(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
	Total Income from operations	5.55	23.5	9.20	65.21	29.53	98.33
	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	-5.50	15.44	4.74	37.21	15.10	-90.89
	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary Items)	-5.50	15.44	4.74	37.21	15.10	-90.89
	Total Comprehensive Income for the period (after tax)	-5.55	15.44	4.74	37.21	15.10	-90.89
6	Paid up Equity Share Capital	500	500	500	500	500	500
7	Reserve (excluding Revaluation Reserve)	-	-	-	-	-	878.51
8	Earnings Per Share (of Rs. 10/- each) (Basic and Diluted)	-0.11	0.31	0.09	0.74	0.30	-6.52

Note:  
1. The above is an extract of the detailed format of Un-audited Financial Results for the quarter and Nine Months ended on 31st December, 2022 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 as amended.  
2. The full format of the said results are available on the website of stock exchange at [www.bseindia.com](http://www.bseindia.com) and at the website of the Company at [www.mehtaintegratedfinance.com](http://www.mehtaintegratedfinance.com)

For, Mehta Integrated Finance Limited -sd/-  
Date: 10.02.2023  
Place: Ahmedabad  
Chirag D. Mehta  
Whole-time Director  
(DIN: 00484709)

**EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2022 (Rs. in Lakhs except EPS)**

SN	Particulars	Quarter Ended		Nine Months ended		Year ended
		31-Dec-22	30-Sep-22	31-Dec-22	31-Mar-22	
1	Total Income from Operations	2,55,239.55	2,52,541.43	7,67,112.79	10,23,377.22	
	Net Profit for the period					
2	(Before Tax After, Exceptional and/or Extraordinary Items)	3,908.01	3,035.68	9,898.73	13,250.27	
3	Net Profit for the period Before Tax (After Exceptional and/or Extraordinary Items)	3,908.01	3,035.68	9,898.73	13,250.27	
4	Net Profit for the period After Tax (After Exceptional and/or Extraordinary Items)	2,919.29	2,240.47	7,351.99	10,297.79	
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,919.29	2,240.47	7,351.99	10,304.40	
6	Equity Share Capital (Face value of Rs. 2/- each)	2,861.45	2,861.45	2,861.45	2,861.45	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	37,792.58	
8	Earnings Per Share (of Rs.2/each) (for continuing and discontinued operations)					
1.	Basic:	2.04	1.57	5.14	7.55	
2.	Diluted:	2.04	1.57	5.14	7.55	

Note: The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated financial results are available on stock exchange websites: [www.bseindia.com](http://www.bseindia.com) (Scrip Code-539725) and [www.nseindia.com](http://www.nseindia.com) (Scrip Symbol-GOKULAGRO) and on Company's website at [www.gokulagro.com](http://www.gokulagro.com).

For & on behalf of Board of Directors of Gokul Agro Resources Limited -sd/-  
Date: 9th February, 2023  
Place: Ahmedabad  
Jayesh Thakkar  
Managing Director (DIN : 03505068)

